

Due to 'Corona lockdown' Wedding, Event & Exhibition Industry makes huge losses



Ahmedabad, The nationwide series of 'lockdowns' announced by the government of India in attempt to prevent the transition of COVID-19 has adversely affected on a large scale to every industry that ultimately paralyzed the economy of the country. The impact of this has not even spared Rs. 10,000-crores' worth giant wedding, events and exhibition industry from experiencing the recession. Through, with a view to support the economy, the government has granted the permission to almost every industry to reopen its business in compliance with guidelines and directions issued by it. Despite the permission granted

Prosus Sica Launched In Partnership With Invest India And Social Alpha

Ahmedabad, Prosus, the global consumer internet group of Naspar, announced the launch of the Prosus Social Impact Challenge for Accessibility (Prosus SICA) in collaboration with Invest India and Social Alpha. Mr. Deepak Bagla, MD & CEO, Invest India, said: "The excellence of Indian ingenuity has been at the forefront throughout the pandemic. The ability of our entrepreneurs to pivot and develop impactful frugal solutions is India's strength. As we move towards an Atmanirbhar Bharat, envisioned by the Hon'ble Prime Minister, it becomes imperative to ensure that India builds on these strengths and provides solutions for challenges being faced across the world. This challenge, aimed at developing assistive technologies for persons with disabilities, will aid in achieving this vision." Mr. Manoj Kumar, Chairman & Founder, Social

So far, Rajasthan has recorded normal rainfall during this monsoon: Report

Jaipur, Rajasthan has recorded normal rainfall so far during this monsoon season with 17 of its 33 districts falling under the normal rainfall category, a report by state's water resources department said. Rajasthan recorded 474.37mm rains from June 1 to September 5, which is 2.3% more than the average rainfall of 463.67mm, the report stated adding that 119 out of the total 742 dams are completely filled, 390 are partially filled and 233 are still empty. On Saturday, light to moderate rainfall continued in several parts of the state and Chhatargarh in Bikaner district recorded a maximum of 7cm rainfall, the Meteorological Department (MET) said. Rainfall in Rajasthan was 6.94% more than the average during this time in 2019. The water resources

PADMANABH INDUSTRIES LIMITED

(CIN: L1710G1994PLC023396)
Regd. Office: 401, ABHISHREE AVENUE, OPP. HANUMAN TEMPLE, NEHRUNAGAR CIRCLE, AMBAWADI, AHMEDABAD-380015
Contact Details:
 Email: padmanabhindustries@gmail.com
 Website: www.padmanabhindustries.com

NOTICE
 Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on Monday, 14th September, 2020 at the Registered Office of the Company to consider and approve inter alia, un-audited Financial Results of the Company for the quarter ended on 30th June, 2020 and to transact the other business mentioned in the Board Meeting Notice.

The said notice is also available on the website of the Company at www.padmanabhindustries.com and on the website of Stock Exchange where shares of the Company are listed i.e. www.bseindia.com

For, Padmanabh Industries Limited
 Sd/-
Ashish Shah
Managing Director
 (DIN: 03129200)

LESHA INDUSTRIES LIMITED

(CIN: L27100G1992PLC018607)
Regd. Office: 7th Floor, Ashoka Chambers, Mithalkai Six Roads, Ahmedabad-380006.
Phone No.: 079-26436227.
E-mail ID: info@lesha.in Website: www.lesha.in

CORRIGENDUM TO THE NOTICE OF ANNUAL GENERAL MEETING
 This has reference to the notice dated August 25, 2020 and advertisement published on September 3, 2020 in Free Press Gujarati (English newspaper) and September 4, 2020 in Lokmitra (Gujarati newspaper) convening Annual General Meeting (AGM) of the members of the Company on Friday, 25th day of September, 2020 at 12:30 P.M. through VCA/OMV, for seeking approval of the members on the matters contained in the Notice for holding of AGM. In the Notice is hereby notified through this Corrigendum to all the members/stakeholders. In the Notice and Explanatory statement of the notice; the name Ashok Shah and Ajit K. Shah wherever appears, shall be read as Ashok Chirubhai Shah; the name Shailesh Shah and Shailesh A. Shah wherever appears, shall be read as Leena Ashok Shah; the name Leena Shah and Leena A. Shah wherever appears, shall be read as Leena Ashok Shah; and the name Lesha Ventures Private Limited wherever appears, shall be read as Lesha Ventures Private Limited (Formerly known as Lesha Agro Foods Private Limited).

For, Lesha Industries Limited
 By order of Board
 SD/-
Shailesh Ashok Shah
Director
 DIN: 00297447

NetAnalytics announces its Recruitment Plans



Ahmedabad, Despite the Global Pandemic Scare, Ahmedabad based NetAnalytics, a company which currently employs just a dozen of Engineers, has pulled off one of the most impressive technology innovations in recent times. NetAnalytics which is a Stealth Startup founded by a team of top performing Network Reliability Engineers, Staff Software Engineers, Network Architects and Network Data Scientists across the Globe and has offices in California, Ukraine and Ahmedabad. The Company is now gearing up to provide opportunities for hardline Techies especially from Gujarat

Sr. No.	LC No.	Km	Date of closure of Road users can use	Road users can use
1	223	746/14-15	09.09.2020 to 18.00 Hrs.	LC No.220 @ KM 221 @ KM 744/6-3 (RUB) & LC 222 @ KM 749/1-2 (KUB)

ASYA INFOSOFT LIMITED
 (CIN: L72900G1985PLC029849)
Regd. Office: H.N. HOUSE 4TH FLOOR NIDHI COMPLEX NAVRANGPURA AHMEDABAD - 380009.
Phone No.: 079-26462344 EMAIL: sayain@gmail.com
Website: www.sayaait.com

NOTICE
 Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of the Board of Directors of the Company will be held on Tuesday, 15th September, 2020 at the Registered Office of the Company, to inter alia consider Un-audited Financial Results (both Standalone & Consolidated) for the First Quarter ended on 30th June, 2020. The said notice is also available on the website of the Company at www.sayaait.com and on the website of Stock Exchange where shares of the Company are listed i.e. www.bseindia.com.

For ASYA Infosoft Limited
KETAN N. SHAH
Managing Director
 Place :- Ahmedabad
 Date: 07/09/2020

OkCredit and Delhi Capitals Join Hands to Empower Small Businesses



Ahmedabad, OkCredit-Digital India ka Digital Bahikhata, has announced its partnership with Delhi Capitals (DC) as their Principal Sponsor for the upcoming season thirteen of Indian Premier League (IPL), starting on 19th September 2020 in UAE. Commenting on the partnership, Mr. Harsh Kohli, Chairman, Co-founder & CEO, OkCredit, said, "We are pleased

PUROHIT CONSTRUCTION LIMITED

(CIN No. L45200G1991PLC015878)
Regd. Office: 401, PUROHIT House, Opp. S.P. Stadium, Navrangpura, Ahmedabad 380 009.
Email: cs@purohitconstruction.com, Phone no: 079-66260104
Website: www.purohitconstruction.com

NOTICE
 NOTICE is hereby given that the 29th Annual General Meeting ("AGM") of the PUROHIT CONSTRUCTION LIMITED will be held on Wednesday, September 30, 2020 at 4.00 p.m. through two way Video Conferencing (VC) facility / Other Audio Visual Means (OAVM), in accordance with the applicable provisions of the Companies Act, 2013 and compliance with circulars issued by Ministry of Corporate Affairs (MCA) dated 5th May 2020 read with circulars dated 8th April, 2020 and 13th April, 2020 and SEBI circular dated 12th May 2020 (collectively referred to as "Circulars") to transact the business as set out in the Notice of the AGM. In compliance with above mentioned Circulars, Notice of AGM and Annual Report of the Company for the Financial Year 2019-20, have been sent through electronic mode to the shareholders who have registered their e-mail IDs with depositories or with the Company. The aforesaid documents are also available on the Company's website www.purohitconstruction.com and website of stock exchange i.e. BSE Ltd at www.bseindia.com and on the website of NSDL i.e. www.evoting.nsdl.com. The Company has provided its shareholders remote e-voting facility in compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 and relevant rules made thereunder and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015. The Company has engaged NSDL as the authorized agency to provide e-voting facility to its all members. The cut-off date to determine eligibility to cast votes by electronic voting is September 23, 2020. The remote e-voting facility shall be open for three (3) days, commencing at Sunday, September 27, 2020 at 10:00 a.m. (IST) and ends on Tuesday, September 29, 2020 at 5:00 p.m. (IST) for all the shareholders, whether holding shares in physical form or in dematerialized form. Remote e-voting facility shall not be allowed beyond the said date and time. The members who remain present in the AGM through VCA/OMV facility and had not cast their votes on the resolutions through remote e-voting are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting facility during the AGM. The members may participate in the meeting even after exercising their right to vote through remote e-voting but shall not be allowed to vote again during the meeting. Detailed instructions for remote e-voting facility are given in the 'Notice of the AGM'. The members who have not registered their email IDs with the Depository Participant/Registrar and Share Transfer agent of the Company and are willing to vote through e-voting are requested to refer to detailed instruction for remote e-voting facility and e-voting at AGM forming part of the Notice of AGM. Any person who acquires shares and becomes shareholder of the Company after the dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date may cast their votes by following the instructions and process of e-voting as provided in the Notice of AGM. In case Member who has not registered their e-mail address, they may follow the following instructions;

- Member holding shares in Physical mode are requested to send an email to cs@purohitconstruction.com alongwith necessary details like full name, Name of the Member and self attested copy of PAN card and Aadhar Card for registering their email addresses.
- Member holding shares in Demat mode are requested to contact their respective Depository Participant for registering the email addresses.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evotingindia.com or call toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.com.

FOR PUROHIT CONSTRUCTION LIMITED
 Sd/-
Narendra Purandara
Chairman & Managing Director
 (DIN: 00755195)
 Date: 7th September, 2020
 Place: Ahmedabad

AROMA ENTERPRISES (INDIA) LIMITED

Reg. Off.: 88, Ajanta Commercial Centre, N. Income Tax Circle, Ashram Road, Ahmd - 380009
E - Mail : compliance.mgc@gmail.in;
Website : www.aromaenterprises.in;
Tel.:+ 91 79 27540175 CIN : L51909G1994PLC021482

Notice of 26th Annual General Meeting, E - Voting and Book - Closure
 Notice is hereby given that:

- The 26th Annual General Meeting (AGM) of the members of Aroma Enterprises (India) Limited (the "company") will be held on Wednesday 30th September, 2020 at 11:00 A.M IST through video conferencing/ Other Audio Visual Means (OAVM) in accordance with the provisions of the Companies Act, 2013 and circulars issued by Ministry of Corporate Affairs (MCA) and circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "Circulars") to transact the business as set out in the Notice of the AGM and Annual Report 2019-2020 have been sent to all the members whose email IDs are registered with the company/ Depository Participant(s). These documents are also available on the website of the company at www.aromaenterprises.in, Stock exchange website and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com. The dispatch notice of the AGM through emails has been completed on 7th September, 2020.
- Members Holding shares either in Physical form or dematerialized form, as on the cut-off date (25th September, 2020), may cast their votes electronically on the business as set forth in the notice of AGM through the electronic voting system of NSDL ('remote e-voting'). Members are hereby informed that:
 - The Business as set forth in the Notice of AGM may be transacted through remote e-voting or e-voting system at the AGM.
 - The remote e-voting commences from Saturday, 26th September, 2020 10:00 a.m. and shall end on Tuesday, 29th September, 2020 at 05:00 p.m.
 - The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the AGM shall be 25th September, 2020
 - Remote e-voting module will be disabled after 5:00 p.m. IST on 29th September, 2020
 - Any person, who acquires shares of the company and becomes a member post-dispatch of the notice of the AGM and holds shares as on cut-off date i.e. 25th September, 2020 may obtain the log in ID and password by sending a request at evoting@nsdl.com. However, if a person is already registered with NSDL for e-voting then the existing used ID and password can be used for casting their vote;
 - Member may note that: a) The remote e-voting module shall be disabled by NSDL beyond 5:00 p.m. IST on 29th September, 2020 and once the votes on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility for voting will also be made available during the AGM, and those members present in the AGM through facility, who have not cast their vote on the resolution to vote through remote e-voting or otherwise not barred from doing so, shall be eligible to vote through the voting system at the AGM. c) the members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their votes again, and d) only persons whose name is recorded in the register of members or in the register of beneficial owners as maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote voting at the AGM.
- The manner of voting remotely for members holding shares in Dematerialized mode, physical mode and for members who have not registered the email address is provided in the notice of the AGM. The details will also be made available on the website of the company. Members are requested to www.aromaenterprises.in to obtain such details.
- Members who have not registered the email address are requested to register the email addresses with respective depository participant(s) and members holding shares in physical mode are requested to update the email addresses with company's Registrar and share transfer agent, Skyline Financial Services Private Limited, at info@skylinefinancial.com to receive copies of the annual report, 19-20 along with the notice of the 26th AGM. Instructions for remote e-voting and instructions for participating in the AGM through VC.
- In case of queries relating to remote e-voting, members may refer to the frequently asked questions (FAQs) for members and e-voting user manual or members at the download section NSDL website for call toll free number: 1800-22-9900 or contact 8494450770.
- Pursuant to Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Rules, 2015, the Register of Members and share transfer book of company will remain closed from Saturday, 26th September, 2020 to Wednesday 30th September, 2020 (Both Days Inclusive) for the purpose of Annual General Meeting of the company.

For, Aroma Enterprises (India) Limited
 SD/-
Mr. Snehal Patel
Managing Director
 (DIN: 03097321)
 Date : 07.09.2020
 Place: Ahmedabad

UTL INDUSTRIES LIMITED

Registered Office: 607, World Trade Centre, Sayajigunj, Vadodra-390005, Gujarat
 L27100G1989PLC012843
 Email ID: utlindustries@gmail.com, website: www.utlindustries.com

NOTICE OF ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE
 Notice is hereby given that the 31st Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on Wednesday, 30th September, 2020 at 5:30 p.m. IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the business, as set out in the Notice of the AGM. In view of the continuing COVID-19 pandemic, the Ministry of Corporate Affairs ("MCA") has vide its General Circular No. 17/2020 dated 5th May, 2020 and General Circular No. 14/2020 dated 8th April, 2020 and General Circular No. 17/2020 dated 13th April, 2020 (collectively referred to as "MCA Circulars") permitted the holding of the AGM through VC / OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations, 2015") and MCA Circulars, the AGM of the Company will be held through VC / OAVM. The instructions for joining the AGM through VC/OAVM are provided in the Notice of the AGM. Members attending the AGM through VC / OAVM shall be deemed for the purpose of reckoning the quorum under Section 102 of the Act. The Company is pleased to provide its Members the facility of casting votes using an e-voting system ("remote e-voting"), through the e-voting services provided by National Securities Depository Limited ("NSDL"). Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). The Members who have cast their vote by remote e-voting may also participate in the AGM, but shall not be entitled to cast their vote again. The detailed procedure for remote e-voting and e-voting during the AGM is provided in the Notice of AGM. The remote e-voting period begins on 26th September, 2020 at 9:00 a.m. IST and ends on 29th September, 2020 at 5:00 p.m. IST. The Members of the Company, holding shares as at cut-off date of 23rd September, 2020 may cast their vote either by remote e-voting or by e-voting during the AGM. Any member, who has acquired shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on 23rd September, 2020, may obtain the log ID and password by sending request at evoting@nsdl.com in the remote e-voting module shall be disabled by NSDL for voting after 29th September, 2020 at 5:00 p.m. IST. In compliance with the aforesaid MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, Notice of the AGM along with the Annual Report will be sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company's Depositories. The process for registration / updation of Email ID and updation of bank account mandate for receipt of dividend is as under:

- In case shares are held in physical mode, members are requested to visit the website of Company's Registrar & Share Transfer Agent ("RTA"), PurvaShare (India) Private Limited <http://www.purvashare.com> and update the email ID and phone number at evoting@nsdl.com, Tel: +91 222 494545 / 1800-222-990.
- In case shares are held in demat mode, members are requested to register / update Email ID and bank account details with their respective Depository Participants.

Pursuant to the provisions of section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, the Register of members and Share Transfer books of the Company will remain closed from Thursday, 24th September 2020 to Wednesday, 30th September 2020 (both days inclusive) for the purpose of Annual General Meeting.

Members may note that the Notice and Annual Report will also be available on the Company's website www.utlindustries.com, website of stock exchanges i.e. BSE Limited at www.bseindia.com and on the website of NSDL at www.evoting.nsdl.com. Grievances connected with voting may be referred to Ms. Pallavi Mahatre, NSDL, 4th Floor, A Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Panel, Mumbai-400 013. Email id: evoting@nsdl.com / pallavi@nsdl.com. Tel: +91 222 494545 / 1800-222-990. For detailed instructions pertaining to e-voting, members may please refer to the Notice of AGM. In case of any queries or grievances pertaining to the e-voting procedure, members may get in touch with the following:

For UTL Industries Limited
 SD/-
Parimal Shah
Managing Director
 (DIN: 00569489)
 Purva Sharecity (India) Pvt Ltd.,
 Jivhi Shakti Industrial Estate,
 J R Boricha Marg, Opp. Kasturba Hospital, Lower Panel (E),
 Mumbai-400 011
 Email: support@purvashare.com | Email: utlindustries@gmail.com
 Tel: +91 222 494545 / 1800-222-990
 607, World Trade Centre, Sayajigunj, Vadodra-390005, Gujarat

For, Aroma Enterprises (India) Limited
 SD/-
Mr. Snehal Patel
Managing Director
 (DIN: 03097321)
 Place : Vadodra
 Date: 07.09.2019